

## ગાય આધ્યારિત પ્રવાહી સેન્દ્રિય ખાતરોની બનાવત અને તેમનો ઉપયોગ

ખેતીમાં વર્તમાન પરિસ્થિતિને જોતા તેમાં થોડા સુધારા લાવવાની જરૂર જણાય છે. તદ્દુરાંત લાંબા સમયથી રસાયણિક ખેતીથી આજે ખેડૂતોની જમીનો બગાડી તથા પાકો, બિયારણ, પર્યાવરણ વગેરે પણ દૂષિત થયા. રસાયણીક દવાઓના વધુ પડતા અને આડિક્ષાડ ઉપયોગને કારણે ખોરાકમાં એતે તત્વોના પ્રમાણમાં વધારો, તેમની ઉત્પાદકતા અને જમીનની ફળદુપતા ઉપર માઠી અસર થતાં ખેડૂતોની મુશ્કેલીઓ વધી, ઉત્પાદન ખર્ચ વધ્યો, પાકમાં રોગ જીવાતનું પ્રમાણ વધ્યુ પરિણામે પર્યાવરણ, મનુષ્ય તેમજ પ્રાણીઓના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર જોવા મળે છે. જેના હિસાબે હાલની ખેતીમાં ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે. જેથી જમીનને ફરી ફળદુપ બનાવવા, ખેતીખર્ચ ઘટાડવા તેમજ તંહુદસ્ત પાક ઉત્પાદન મેળવવા માટે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાની જરૂર છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં ગાયનું ખૂબ મહત્વ રહેલ છે. ગાયના છાણ અને ગૌમુહ્રનો આ ખેતી પદ્ધતિમાં ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકાય છે.

ગાયના છાણ અને ગૌમુહ્રમાંથી વિવિધ પ્રવાહી સેન્દ્રિય ખાતરો બનાવી શકાય, જેવા કે પંચગાવ્ય, જીવાત, અમૃતપાણી, સંહુવક, બીજામૃત વગેરે....., જેમના ઝારા પાકને જરૂર એવા પોષકતત્વનો અને અંતઃસ્ત્રાવો મળી રહે છે.

**પંચગાવ્ય:-**  
પંચગાવ્ય એ પાક માટે ટોનિકનું કામ કરે છે. જે પાકના જડપી વિકાસ અને ફળ કૂલમાં વધારો કરવામાં મદદરૂપ થાય છે.

પંચગાવ્ય બનાવવા માટે સૌપ્રથમ ૭ કિ.ગ્રા. દેશી ગાયનું છાણ અને ૧ કિ.ગ્રા. દેશી ગાયનું દી એક માટીના પ્લાસ્ટિક કે સિમેન્ટના પાશમાં એકઢા કરી મિશ્રણને દરરોજ સવાર સાંજ પંચ મિનિટ સુધી ઘડીયાળની સવડી અને અવડી એમ બને દિશામાં વારાફરતી બરાબર ફેરવંટું, ત્યાર બાદ તે પાત્રને સાદા કપડાથી ટાંકી છાંયાવાળી જગ્યાએ ગણ દિવસ રહેવા દેંનું.

પ્રાણ દિવસ બાદ તેયાર કરેલ મિશ્રણમાં ૧૦ લિટર ગૌમુહ્ર અને ૧૦ લિટર પાણી એમ બંનેને મિશ્ર કરીને ૧૫ દિવસ માટે રાખી મૂકવા, પંદર દિવસ પછી નીચેના ઘટકોનું મિશ્રણ કરવું.

ગાયનું દૂધ - ૩ લિટર  
ગાયનું દહી - ૨ લિટર

(4)

## નાળીએરનું પાણી - ૩ લિટર

શેરડીનો રસ અથવા ગોળ - ૩ કિલો

પાકેલાં કેળા - ૧૨ નંગા

આ બધી ઉપરની વસ્તુઓ પાગમાં ઉપરના કમ મુજબ ઉમેરવી પાગને છાંયાડા હેઠળ ખૂલ્લુ રાખવું અને મિશ્રણને સવાર અને સાંજ બે વખત છલાવવું આ રીતે પંચગાવ્યનું દ્રાવણ શીસ દિવસ પછી તેયાર થઈ શકે. (દ્યાનમાં રાખવા જેવી બાબતો - બેસ ઉત્પાદનના ઘટકો ભેટવવા નહીં). ગાયની સ્થાનિક જાતિઓના ઉત્પાદનના ઘટકો વિકેટી જાતિઓ કરતાં વધારે સામન્ય ધરાવતા હોય છે. તેયાર થયેલ દ્રાવણને વાયરની જાળીદાર અથવા પ્લાસ્ટિકની મર્છજ જાળી ટાંકી દેવું જોઈએ, જેવી તેમાં મર્છજ અને માખીને ઈંડા મુક્તા અટકાવી શકાય છે. જ્યારે શેરડીનો રસ ઉપલબ્ધ ન હોય તો ૩ લિટર પાણીમાં ૫૦૦ ગ્રામ ગોળ ઉમેરી તેનો ઉપયોગ કરવો.

પંચગાવ્ય ઉપયોગ કરવાની રીતો

૧. છંટકાવની રીત

૨. પિયત સાથે ઉપયોગ કરવાની રીત

૩. બીજ માવજત આપવી

૪. બીજ સંશોધ માટે ઉપયોગી


૫. પંચગાવ્યનો ઉપયોગ કરવાનો સમયગાળો:

- કૂલ પહેલાનો લબક્કા: ૧૫ દિવસના ગાળો એવા બે છંટકાવ, પાકના સમયગાળા પર આધાર રાખીને કરવા.
- કૂલ અને શીંગ બેસવા સમયે: ૧૦ દિવસમાં એકવાર એવા બે છંટકાવ કરવા.
- ફળ/શીંગના પૂર્ણ વિકાસ દરમિયાન એક વખત છંટકાવ કરવો.

નોંધ : “આ લેખ ફક્ત ખેડૂતોને વિવિધ પાકોની આધુનિક ટેકનોલોજી અંગે જાણકારી પુરી પાડવા માટે જ છે. જયુડીશીયાલ મેટર માટે નથી”

(5)

## ગુજરાતની દેશી ગાયની ઓલાદોનું પ્રાકૃતિક ખેતીમાં મહિત્વ



### કૃષિ વિજ્ઞાન કેન્દ્ર

નવસારી કૃષિ યુનિવર્સિટી

વધ્ય - ૩૬૪૭૩૦

પ્રકાશન નં. NAU/04/07/081/2023

વર્ષ : ૨૦૨૨-૨૦૨૩

### ગુજરાતની દેશી ગાયની ઓલાદોનું પ્રાકૃતિક ખેતીમાં મહેત્વ

ડૉ. સાગર એ.પટેલ, શ્રી બિપીન અમ. વહુનિયા  
ડૉ. જે. બી. ડોબરીયા, શ્રી રાકેશ એસ. પટેલ  
ડૉ. પ્રતિક પી. જાયિયા

ભારતમાં તેમજ ધણા એશિયન દેશોમાં ગાય પચિત્ર પ્રાણી તરીકે ઓળખાય છે. પૃથ્વી પર ગાય એ એકમાત્ર અનું પ્રાણી છે. જે માતા તરીકે ઓળખાય છે. અને જે તેના ઉત્પાદ ક્રિયાનું દુધ અને અન્ય ઉત્પાદનો રૂપે લોકોને આશીર્વાદ આપે છે. હાલના સમયમાં પણ ભારતના ધણા ગામડાઓમાં ગાયના ગોલારનો બળતણ તરીકે ઉપયોગ થાય છે. ગાયનું દુધ, ગાયનું ધી, દર્દી તેમજ ગાયના દુધમાંથી બનતા અન્ય ડેરી ઉત્પાદનોને ખૂબ જ પોષિક ગણવામાં આવે છે. તમારા રોજિંદા આહારમાં ગાયના દુધ અને ગાયના ધીની આદત વમને તંદુરસ્ત રાખે છે. અને રોગ-પ્રતિકારકસત્તા વધારે છે. આચ્યુરેંડમાં ધણા રોગોના ઈલાજ માટે પણ ગૌમુહનો ઉપયોગ થાય છે. ગાય કેટલાક ઉત્પાદ લક્ષણો જેવા કે ધીરજ, સાહિષ્ણ્યતા, સૌભાગ્યતા, તેમજ અન્ય ગુણો પણ ધરાવે છે.

૧. ગીર:-  
ગીર ગાય બીજા કેટલાક નામ જેવા કે કાઠીયાવાડી, સુરતી અને ડકનાના નામની પણ ઓળખાયામાં આવે છે.

ઉદ્ભવસ્થાન:-  
ગીર ગાય ગીરના જ્ંગલોમાં મૂળ રીતે જોવા મળે છે. આ ઓલાદનું ઉદ્ભવ સ્થાન પણ અહીંથી જ થયું હોય એમ જાણવા મળે છે. હાલમાં ગીર ગાય આજુભાજુના વિસ્તારમાં પ્રસરી છે.

### શારીરિક લક્ષણો:-

ગીર ગાયના શારીરિક લક્ષણો જોવામાં આવે તો તેના રંગ મોટા ભાગે લાલથી દેરા રાતા રંગનો અને કોઈક વાર સફેદ ટપકાં જોવા મળે છે. તેનું માણું ઉપસેલું અને ગોળકાર હોય છે. તેના શીગાડાં માથાની સહેજ નીચેની બાજુથી નીકળી પાછળની તરફ જતા હોય અને કટાર આકારના જેવા દેખાય છે. તેની પીઠ સીધી અને એકદમ સમતલ જોવા મળે છે. કાન મધ્યમ કદના અને નાના વળોલા પાન જેવા દેખાય છે. ગીર ગાયની પૂછડી ચાબુક જેવી અને તેનું ગુરુછ કાળ રંગનું હોય છે.

વજન: ગીર ગાય : સરેરાશ ૩૮૯ કિલો  
ગીર સાંંઠ - સરેરાશ ૫૪૪ કિલો

(૨)

### આર્થિક લક્ષણો :-

દુધ ઉત્પાદન :- સામાન્ય રીતે ૧૭૪૬ થી ૩૨૭૫ કિલો. પરંતુ સારી ઓલાદની ગાયનું દુધ ઉત્પાદન ૨૯-૨૭ કિલો સુધી જઈ શકે છે અને આવી ગાયનું વેતરનું દુધ ઉત્પાદન ૪૫૦૦ કિલોથી પણ વધુ મળી શકે છે.  
પ્રથમ વિયાણ ઉંમર : ૪૦-૫૦ મહિના

બે વિયાણ વર્ચેનો સમયગાળો - ૪૩૦-૪૬૦ દિવસ

દુધમાં ફેટનું પ્રમાણ - ૪.૫ થી ૫.૫ ટકા

સમગ્ર વિશ્વમાં ગીર ગાય તેના ઉત્પાદ ગુણોના કારણે શ્રેષ્ઠ જાતિ તરીકે ગણવામાં આવે છે. વધુ દુધ ઉત્પાદનથી લઈને વધુ સંખ્યામાં વાઇરટાને જન્મ આપવા માટે, ગીર ગાય અન્ય જાતિની સરખામણીમાં હોયનું સ્થાન ધરાવે છે. જ્યારે ગીર ગાયની દુધની વાત કરીએ તો તેનું વધુ શક્તિ અને વધુ પોષિકતાની સાથે ઓછું ફેટ લોકોના સ્વસ્થાય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે તમારા શરીરમાં ફેટનું સ્તર વધારતું નથી. પરંતુ તમારા શરીરને વધુ તાકાત આપે છે. જે વમને તંદુરસ્ત રહેવામાં મદદ કરે છે. તે તમારા શરીરનું કોલેસેટોલ લેવલ નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે તમારું વજન જાળવી રાખવા માટે પણ ઉપયોગી છે. તેમજ ઓછું વજન ધરાવતા લોકોને વજન વધારવા અને વધુ વજન ધરાવતા લોકોને વજન ધાટડવા માટે મદદ કરે છે. ગીર ગાયનું મૂત્ર આચ્યુરેંડમાં શ્રેષ્ઠ ઔષ્ણ તરીકે ગણવામાં આવે છે. તેના ૧૬ પોષક તત્વો નાના થી મોટા રોગોના ઈલાજમાં તેમજ આપણી રોગપતિકારક શક્તિ સુધારવામાં મદદરૂપ છે. ગીર ગાયના ગોબરમંથી બનાયેલું ખાતર, ખેડૂતોને તેમની જમીન ફળદુપ બનાવવા અને પાકનું ઉત્પાદન વધારવામાં ખૂબ ઉપયોગી છે.

### ૨. કાંકડેજ:

#### ઉદ્ભવસ્થાન :

કાંકડેજ ગાય ગુજરાતમાં દક્ષિણ કાચી, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, પેડા, સાબરકાંઠા અને રાજ્યસ્થાનના બાડમેર અને જોધપુર જિલ્લાઓમાં જોવા મળે છે.

કાંકડેજ ગાય બઢી, વાગોડિયા, વઠિયાર અને નગુના હુલામણા નામથી પણ ઓળખાયામાં આવે છે.

#### શારીરિક લક્ષણો :

કાંકડેજ ગાયનો રંગ સફેદ મળે છે. ગાયના ખુંદથી પાછળના ટેકા સુધીની ઉપરની પર્ણી દેરા કાળા રંગની જોવા મળે છે. કાંકડેજ ગાયનું કપાળ ડીશ જેવું અને સહેજ કાળા રંગનું જોવા મળે છે. તેના કાન મોટા

(૩)

અને લટકતા જોવા મળે છે. તેની ચાલ મોટા ડગલાંની હોવાથી તેને “સવાઈ ચાલ” થી પણ ઓળખાયામાં આવે છે. આંખો મોટી અને મેંસ નાખેલી જોવા મળે છે. શીગાડાં મોટા અને માથાના ઉપરના ભાગમાંથી નીકળતા હોય તેમ લાગે છે.  
વજન: કાંકડેજ ગાય : સરેરાશ ૪૫૦ કિલો  
કાંકડેજ સાંઠ : સરેરાશ ૧૦૦ કિલો

### આર્થિક લક્ષણો :

દુધ ઉત્પાદન : સરેરાશ ૧૭૫૦ કિલો

પ્રથમ વિયાણ ઉંમર : સરેરાશ ૪૭.૩ મહિના

બે વિયાણ વર્ચેનો સમયગાળો સરેરાશ ૪૦૦ દિવસ

દુધમાં ફેટનું પ્રમાણ : સરેરાશ ૪.૮ ટકા (૪.૭૭ ટકા થી ૪.૮૮ ટકા)

### ૩. ડંગી:

ડંગાના જ્ંગાલ વિસ્તારમાં ફ્લાની ઓલાદની ગાયો જોવા મળે છે. તે ડંગાના જ્ંગાલમાં જોવા મળતી હોવાથી તેને ડંગી કહે છે.

#### શારીરિક લક્ષણો:-

ડંગી ગાયનો રંગ દેરા બદામી અને એમાં પણ નીચેના પેટના ભાગથી સહેજ સુધી સફેદ રંગના ધર્મા જોવા મળે છે. તેની ચામડી લીસ્ટી હોય છે. ગાયનો બાંધો મધ્યમ અને મજબૂત હોય છે. તેના શીગાડાં દૂંકા, જાડા અને આગામના ભાગથી અણીદાર જોવા મળે છે.

વજન: - ડંગી ગાય : સરેરાશ ૩૫૦ કિલો

ડંગી સાંઠ :- સરેરાશ ૪૫૦ કિલો

દુધ ઉત્પાદન : સરેરાશ ૫૦૦-૭૦૦ કિલો (૨૫૮ દિવસમાં)

પ્રથમ વિયાણ ઉંમર : સરેરાશ ૪૫ મહિના

બે વિયાણ વર્ચેનો સમયગાળો સરેરાશ ૫૦૦ -૫૨૦ દિવસ

દુધમાં ફેટનું પ્રમાણ : સરેરાશ ૪.૫ ટકા

(૪)